



સીટી ઓફ બ્રેમ્પટને બધી સેમિટરીસ આજે, જૂન 19 થી ફરીથી ખુલ્લી મૂકી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 19, 2020) – સીટી ઓફ બ્રેમ્પટનના રિઓર્નિંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે, શહેરની બધી સેમિટરીસ આજે, જૂન 19 થી ફરીથી ખુલ્લી મૂકવામાં આવી છે.

સેમિટરીસ સોમવારથી રવિવાર સુધી સવારે 7:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ શહેર સામુદાયિક આરોગ્ય અને સુરક્ષાને ગંભીર રીતે લે છે, અને શારીરિક અંતર જાળવવાના ઉપાયો સેમિટરીસમાં અમલમાં રહેશે. મુલાકાતીઓને બધાં સમયે એકબીજાથી ઓછામાં ઓછાં બે મીટર (છ ફૂટ) દૂર રહેવાની વિનંતી કરવામાં આવે છે.

સેમિટરીના દરવાજાઓ અંતિમવિધિ દરમિયાન ક્ષમતા મહત્તમ થાય એટલે બંધ કરવામાં આવશે. સર્વિસીસ પૂરી થયા પછી દરવાજાઓ ફરીથી ખોલવામાં આવશે.

સેમિટરી ઓફિસ માત્ર એપોઈન્ટમેન્ટ દ્વારા ખોલવામાં આવે છે. આવશ્યક સેવાઓ, જેમ કે દફનવિધિ અને દફન પ્લોટ વેચાણ, માત્ર એપોઈન્ટમેન્ટથી પૂરું પાડવાનું ચાલુ રહેશે. રહેવાસીઓને એપોઈન્ટમેન્ટ નોંધાવવા 905.874.2997 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે.

સેમિટરી બાય-લો (પેટા-કાનૂન) 83-2016 પ્રમાણે સેમિટરીસમાં કૂતરાઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સેમિટરીસ બહાર આરોગ્ય અને સુરક્ષા માર્ગરેખાઓ સંબંધિત સાઈન બોર્ડ મૂકવામાં આવશે. રહેવાસીઓને કોઈ મુદ્દાઓ નોંધાવવા કોર્પોરેટ સિક્યુરિટી સર્વિસીસને 905.874.2111 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન, બ્રેમ્પટન સેમિટરી, તેમજ 25 અગ્રણી સેમિટરીસનું સંચાલન કરે છે. બ્રેમ્પટન સેમિટરીસની યાદી [અહીં ઉપલબ્ધ છે](#).

COVID-19 સુરક્ષા ઉપાયો

સીટી રહેવાસીઓને પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું, પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું અને નોન-મેડિકલ મારક્સ પહેરવાનું પણ યાદ અપાવે છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા માટે વેબસાઈટ www.brampton.ca/covid19 જુઓ, અને કોઈપણ સમયે સીટી ઓફ બ્રેમ્પટન અને રીજીયન ઓફ પીલ સુધી પહોંચવા 311 નંબર પર કોલ કરો.

અવતરણો (ક્વોટ્સ):

“શહેરની સેમિટરીસને ફરીથી ખોલવી એ બ્રેમ્પટન માટે પોતાના રિઓર્નિંગ અને રિકવરી પ્લાનમાં મહત્વનું પગલું છે. આનો અર્થ રહેવાસીઓ, ખાસ કરીને પોતાના પ્રિયજન ગુમાવનાર લોકો માટે શું થાય તે આપણે જાણીએ છીએ. અમે રહેવાસીઓની જરૂરિયાતો અને સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાને અગ્રતા આપવા ખંતપૂર્વક કામ કરી રહ્યા છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“રિઓર્નિંગ અને રિકવરી વર્કિંગ ગ્રૂપ મારફતે, અમે સમુદાય સાથે અર્થસભર ચર્ચાઓ કરવાનું ચાલુ રાખીને ખાતરી કરાવીએ છીએ કે આપણી સગવડો અને સુવિધાઓને ફરીથી ખોલવામાં વ્યાપક અભિગમ અપનાવવામાં આવે. રહેવાસીઓ પોતાના પ્રિયજનોને યાદ કરી શકે તેવી આ મહત્વની સીટી સર્વિસ સુરક્ષિત રીતે પૂરી પાડવા અમે સેમિટરીસ ફરીથી ખોલી રહ્યાં છીએ.”

- માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), રિઓર્નિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન

“શહેરની સેવાઓ અને સગવડો સુરક્ષિતપણે ખોલવી એ સીટી ઓફ બ્રેમ્પટન અને અમારા કર્મચારીઓ માટે ટોચની અગ્રતા ધરાવે છે. અમે જવાબદારીપૂર્વક અને સુરક્ષિત રીતે શહેરની સેવાઓ ફરીથી ખોલીએ તે ખાતરી કરાવવા અમે જરૂરી પગલાઓ લેવાનું ચાલુ રાખીશું.”



- डेविड बर्रिक (David Barrick), चीफ़ अडमिनिस्ट्रेटिव ओफिसर, सीटी ओफ़ ब्रैम्पटन

-30-

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाट

सीटी ओफ़ ब्रैम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca